

હોન :-

પાટણ : ૨૩૦૦૬૮/૨૨૦૨૨૮
ફેક્ટ : ૨૨૧૩૪૭
હારીજ : ૨૨૨૪૦૪
ઉંઝા : ૨૩૫૪૧૯
અમદાવાદ : ૪૦૨૩૨૧૯૨



ડી. પી. ઠક્કર એન્ડ કું.
ડી. પી. ઠક્કર એન્ડ બ્રધર્સ
ટેક્સ કન્સલ્ટન્ટ્સ
'શ્રી કુંજ', સ્ટેશન રોડ, પાટણ.

લાભારી : ભીષ્મી હોસ્પિટલ બિલ્ડીંગ, સ્ટેડીયમ કોમર્સ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૯

ભાઈશ્રી,

તા. ૨૮-૩-૨૦૧૩

આલુ નાણાકીય વર્ષ તારીખ ૩૧-૩-૨૦૧૩ ના રોજ પૂરું થાય છે જે નાણાકીય વર્ષ માટે એસેસમેન્ટ વર્ષ ૨૦૧૩-૧૪ છે એટલે નાણાકીય વર્ષની લાગુ પડતી ઇન્કમેટેક્સ તથા VAT કાયદાની કેટલીક અગત્યની નીચે લખેલી બાબતો સમજાવે અમલ કરવો જરૂરી છે.

(૧) T.D.S. જુદા-જુદા પ્રકારની ઇન્કમેટેક્સ કપાતો :-
T.D.S. ના દરનો કોઠો નીચે મુજબ છે :-

કલમ	ચુકવણીનો પ્રકાર તથા નિયત મર્યાદા	T.D.S. નો દર
194A	(૧) વાર્ષિક રૂ. ૫૦૦૦/- થી વધુ વ્યાજની રકમ ઉપર	૧૦%
	(૨) બેંક તથા પોસ્ટ ઓફીસ માટે વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- થી વધુ વ્યાજની રકમ ઉપર	૧૦%
194C	(૧) વ્યક્તિ તેમજ HUF હોય તેવા કોન્ટ્રાક્ટર કે સબ કોન્ટ્રાક્ટર કે એડવર્ટાઈઝિંગ એજન્ટ માટે (PAN નંબર ફરજિયાત)	૧%
	(૨) ભાગીદારી પેઢી તેમજ કંપની હોય તેવા કોન્ટ્રાક્ટર, સબ કોન્ટ્રાક્ટર માટે (PAN નંબર ફરજિયાત)	૨%
	(૩) ટ્રાન્સપોર્ટરના કેસમાં જે PAN No. પુરો પાડવામાં આવે તો	શૂન્ય
	(૪) ટ્રાન્સપોર્ટરના કેસમાં જે PAN No. પુરો પાડવામાં ન આવે તો	૨૦%
194H	(૧) કમીશન/દલાલી વાર્ષિક રૂ. ૫૦૦૦/- થી વધુ રકમ ઉપર	૧૦%
194I	(૧) પ્લાન્ટ, મશીનરી, ઇક્વીપમેન્ટના ભાડાની રૂ. ૧,૮૦,૦૦૦/- થી વધુ રકમની ચુકવણી ઉપર	૨%
	(૨) જમીન-મકાન, ફર્નિચરના ભાડાની રૂ. ૧,૮૦,૦૦૦/- થી વધુ રકમની ચુકવણી ઉપર	૧૦%
194J	(૧) પ્રોફેશનલ તથા ટેકનીકલ સર્વિસીસ ફી રૂ. ૩૦,૦૦૦/- થી વધુ રકમની ચુકવણી ઉપર	૧૦%
નોંધા-	ઉપર પ્રમાણે જેની કપાત કરવાની હોય તે વ્યક્તિ કપાત કરનારને PAN No. પુરો ન પાડે તો	૨૦%

(૨) વ્યાજની ચુકવણી ઉપર કલમ 194A વ્યાજકપાતની જોગવાઈ :-

- (૧) રૂ. ૫૦૦૦/- કે વધુ વ્યાજની રકમ ચુકવવામાં આવે કે ખાતામાં જમા થાય તો TDS કરવી પડે. પરંતુ તેમાં નીચે પ્રમાણે અપવાદ છે.
- (૧) વ્યાજ મેળવનાર (સ્ત્રી કે પુરૂષ) ની ઉંમર ૬૦ વર્ષ સુધીની હોય અને કુલ આવક રૂ. ૨,૦૦,૦૦૦/- થી ઓછી હોય તો 15G ફોર્મ ત્રણ કોપી માં આપેલો કપાત થાય નહિં.
- (૨) વ્યાજ મેળવનાર (સ્ત્રી કે પુરૂષ) ની ઉંમર ૬૦ વર્ષ થી વધુ હોય અને કુલ ટેક્ષેબલ આવક રૂ. ૨,૫૦,૦૦૦/- થી ઓછી હોય તો 15H ફોર્મ ત્રણ કોપી આપે તો કપાત થાય નહિં અને આ રીતે

(૨)

વ્યાજ મેળવનાર ની ઉંમર ૮૦ વર્ષ થી વધુ હોય તો નેટ ટેક્ષોબલ આવક રૂા. ૨,૫૦,૦૦૦/- થી વધારે હોય પણ રૂા. ૫,૦૦,૦૦૦/- થી ઓછી હોય તો પણ 15H ફોર્મ ત્રણ કોપી માં આપેતો કપાત થાય નહિં.

- (૨) તા. ૩૧/૦૩/૨૦૧૩ ના રોજ વ્યાજનું નામું પાડેલું હોય અને તે પહેલા વ્યાજ ચુકવ્યું ન હોય તો વ્યાજ કપાતની રકમ તા. ૩૦/૪/૨૦૧૩ સુધી ભરવી પડે. અન્યથા જે મહિનામાં કપાત કરી હોય તે પછીના મહિનાની ૭મી તારીખ સુધીમાં કપાત ની રકમ ભરી દેવી પડે.
- (૩) ફોર્મ નં. 15G અને ફોર્મ નંબર 15H માં નીચેની વિગત ભરવી જરૂરી છે.
- (૧) વ્યાજ મેળવનારનું નામ તથા પુરૂ સરનામું એટલે કે મકાનનું નામ, મકાનનો મ્યુનીસીપલ નંબર, રોડ, રસ્તો, એરીયા પીન કોડ નંબર, લેન્ડ લાઇન ટેલફોન નંબર અને મોબાઇલ નંબર
- (૨) ઘંઘાનો પ્રકાર (૩) PAN નંબર
- (૪) ઇન્કમેટેક્સનું છેલ્લું રીટર્ન કઈ સાલ માટે ભરેલ અને કયા વોર્કમાં અને કયા ગામમાં ભરેલું
- (૫) અંદાજે કુલ આવક કેટલી યાશે.
- (૬) જે પેટીમાં પૈસા આપેલા હોય તે પેટીનું વ્યાજ નાંખેલા ખાતાની નકલ ત્રણ કોપી.
- (૪) જો P.A. નંબર ન હોયતો ફોર્મ નંબર 15G કે ફોર્મ નંબર 15H આપી શકાય નહીં પરિણામે વ્યાજ કપાત ૨૦ ટકા લેખે ઘાય.
- (૫) વ્યાજ આપનાર વ્યાજ કપાત ન કરવા માટે જે ફોર્મ નંબર 15G કે 15H ત્રણ કોપીમાં મેળવે તેમાંથી બે કોપી તા. ૭/૪/૨૦૧૩ સુધીમાં અમદાવાદ TDS કમીશનર ની કચેરી કે તેમણે અધિકાર આપેલ ઇ.ટેક્સ કચેરીમાં ફાઇલ કરવા ફરજિયાત છે.
- (૬) ફોર્મ નંબર 15G કે ફોર્મ નંબર 15H તૈયાર કરવા માટે ઉપર જણાવેલી વિગત જેમ બને તેમ તુરત મોકલશો.

(૩) કોન્ટ્રાક્ટ કામની કપાત કલમ - 194-C

- (૧) કોન્ટ્રાક્ટ કામ આપેલું હોય કે સબ કોન્ટ્રાક્ટ કામ આપેલું હોય કે લેબર કોન્ટ્રાક્ટ કે ક્લીનીંગ ફેક્ટરી ને ચાર્જ ચુકવેલો હોય કે કોલ્ડ સ્ટોરેજનું ભાડું ચુકવવાનું હોય કે જોબ વર્ક ચાર્જીસ કે કેટરીંગ ચાર્જીસ કે એક્વર્ટાઇઝમેન્ટ ચાર્જીસ કે સીક્યોરીટી ચાર્જીસ કે ટ્રાન્સપોર્ટ કંપનીને ભાડું ચુકવવાનું હોય વિગેરે પેમેન્ટ કરવામાં આવે ત્યારે આ કપાત કરવી પડે અને ભરવી પડે પરંતુ તેમાં નીચે પ્રમાણે અપવાદ છે :-
- (૧) વર્ષ દરમ્યાન એક સાથે રૂપિયા ૩૦,૦૦૦/- અથવા ટુકડે-ટુકડે મળીને કુલ રૂા. ૭૫,૦૦૦/- થી વધુ રકમનું પેમેન્ટ કરવામાં ના આવે તો આ કપાત લાગુ પડતી નથી અને તે અંગે કોઈ ફોર્મ આપવાની પણ જરૂર નથી.
- (૨) ટ્રાન્સપોર્ટનું ભાડું ગમે તેટલું ચુકવવામાં આવે પણ જેને ટ્રાન્સપોર્ટનું ભાડું ચુકવાય તેનો P.A. નંબર હોય તો આ કપાત કરવાની રહેતી નથી અને P.A. નંબરના પુરાવા માટે ઝેરોસ કોપી માંગવી હિતાવહ છે અને જો ટ્રાન્સપોર્ટનું ભાડું રૂા. ૩૫,૦૦૦/- થી વધુ એક સાથે ચુકવવાનું હોય તો એકાઉન્ટ પેઇ ચેક થી ચુકવવું પડે.
- (૩) ઉપરના અપવાદ સિવાય આ કપાત કરવી અને ભરવી ફરજિયાત છે.
- (૪) ટ્રાન્સપોર્ટર જો P.A. નંબર ધરાવતા ન હોય કે P.A. નંબર ન આપે તો કપાત ૨૦ ટકા લેખે કરવી પડે.

(૪) દલાલી/કમીશન કલમ - 194-H

- (૧) વર્ષ દરમ્યાન ટુકડે ટુકડે કે એક સાથે એકજ પાર્ટીને રૂા. ૫૦૦૦/- થી વધુ રકમ ચુકવવામાં આવેતો આ કપાત કરવી ફરજિયાત છે.
- (૨) આ રીતે જેને દલાલી કમીશન ચુકવવાની હોય તે P.A. નંબર ના આપેતો કપાત ૨૦ ટકા લેખે કરવી પડે.

(૫) પ્લાન્ટ/મશીનરી/ઇક્વીપમેન્ટ ભાડું કલમ - 194-I

- (૧) વર્ષ દરમ્યાન ટુકડે ટુકડે કે એક સાથે એકજ પાર્ટીને રૂા. ૧,૮૦,૦૦૦/- થી વધુ રકમનું ભાડું આપવાનું

(3)

ઘાયતો આ કપાત કરવી પડે.

(૨) વર્ષ દરમિયાન કુલ ભાડું રૂ. ૧,૮૦,૦૦૦/- થી ઓછું આપવાનું ઘાયતો આ કપાત કરવી જરૂરી નથી.

(૬) સ્થાયર મિલકત/ફર્નિચર ભાડુ કલમ - 194-I

(૧) વર્ષ દરમિયાન ટુકડે ટુકડે કે એક સાથે એકજ પાર્ટને રૂ. ૧,૮૦,૦૦૦/- થી વધુ રકમનું ભાડું આપવાનું ઘાય તો કપાત કરવી પડે.

(૨) વર્ષ દરમિયાન કુલ ભાડું રૂ. ૧,૮૦,૦૦૦/- થી ઓછું આપવાનું ઘાય તો આ કપાત કરવી જરૂરી નથી.

(૭) વહીલ-ડૉક્ટર-એડવોકેટ વિગેરેની ફી કલમ - 194-J

(૧) વહીલ ફી, ઓડીટર ફી, ડોક્ટર ફી, હોસ્પિટલ ચાર્જ વિગેરેનું એકજ પાર્ટને વર્ષ દરમિયાન ટુકડે ટુકડે કે એક સાથે રૂ. ૩૦,૦૦૦/- થી વધુ રકમ નું પેમેન્ટ કરવામાં આવે તો આ કપાત કરવી પડે.

(૮) ટેકનીકલ સર્વિસીસ નું પેમેન્ટ - કલમ - 194-J

(૧) ટેકનીકલ સર્વિસીસ એટલે કે એજન્ટ જે સર્વિસ આપતા હોય તેનો જે ચાર્જ લેતા હોય તે ટેકનીકલ સર્વિસીસ ની ફી ગણાય છે. દા.ત. શીર્પીંગ એજન્ટ વેપારી વતી જે કોઈ ખર્ચો કરે અને એજન્ટી ચાર્જ લે તે તમામ રકમ ઉપર આ કપાત લાગુ પડે. ફ્યુમીગેશન ચાર્જ ઉપર પણ TDS કરવી પડે. ઇન્ડીયન શીર્પીંગ કંપનીને ફેઈટ ચુકવો તેના પણ ૨% TDS કરવી પડે.

(૨) વર્ષ દરમિયાન એકજ પાર્ટને રૂ. ૩૦,૦૦૦/- થી વધુ રકમનું પેમેન્ટ આપવાનું ઘાય ત્યારે આ કપાત કરવી પડે અને ભરવી પડે.

(૯) પગાર કપાત - કલમ - 192

(૧) પગાર, બોનસની રકમ નેટ ટેક્સેબલ ઘાતી હોય તો વ્યક્તિના કેસમાં લાગુ પડતા દરથી કપાત કરવી પડે. મેજનનારની નેટ આવક ટેક્સેબલ ઘતી હોય તો વ્યક્તિને લાગુ પડતા ઇન્કમેટેક્સના દર પ્રમાણે કપાત કરવી પડે.

(૨) આ રીતે કપાત કરવાની ઘાય ત્યારે પગારદાર તેમની બીજી આવક ની વિગત આપે તો તેવી આવકને ધ્યાને લઈ પગારમાંથી TDS કરવી પડે.

(૧૦) નોન રેસીડન્ટને ચુકવવામાં આવતી આવક - કલમ - 195

(૧) કોઈપણ વ્યક્તિ કે પેઢી કે HUF નોન રેસીડન્ટ વ્યક્તિ/HUF/ પેઢી / કંપનીને વ્યાજ, ભાડુ વિગેરે ચુકવે કે ખાતામાં જમા કરે તો આ કપાત કરવી પડે.

(૨) નોન રેસીડન્ટને નાની કે મોટી ગમે તે રકમની આવક ચુકવવામાં આવે કે જમા કરવામાં આવે તો આ કપાત લાગુ પડે દા.ત. વ્યાજ રૂ. ૫૦૦/- ચુકવવામાં આવે તો પણ આ કપાત કરવી પડે એટલે કે આ કપાત માટે કોઈ માફી રકમ નથી.

(૩) નોન રેસીડન્ટ કેસમાં જે TDS થઈ હોય તેનું રીફંડ લેવા માટે નોન રેસીડન્ટ નું ઇન્કમેટેક્સ રીટર્ન ભરવું પડે અને નોન રેસીડન્ટ ને આવક વધારે હોય તો ભરવાપાત્ર ટેક્સ સામે આવી TDS ની રકમ બાદ મળે પણ P.A. નંબર હોવો જોઈએ.

(૪) નોન રેસીડન્ટને ચુકવવાની આવકમાંથી કરવાની TDS ના દર નીચે પ્રમાણે છે. (P.A. No. હોય તો)
(૧) U.S.A., U.K., Canada, Australia વિગેરે દેશોમાં રહેતા હોય તેવા નોન રેસીડન્ટ માટે TDS નો દર ૧૫.૪૫ ટકા છે. કારણ આ દેશો સાથે આપણા દેશને D.T.A.A (ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ) કરાર થયેલો છે. અન્ય દેશોનાં TDS દર અમને પુછી લેવા.

(૨) હેપીટલ ગેઈન ટેક્સ વિગેરે આવકો અંગે અલગ-અલગ દર છે તે માટે જરૂર મુજબ રૂબરૂ મળવું.

(૧૧) ટેક્સ કલેક્શન એટ સોર્સ - TCS કલમ - 206-C :-

(૧) જે વેપારી નીચેની વસ્તુઓનું વેચાણ કરતા હોય તેમને જ આ જોગવાઈ લાગુ પડે છે.

(૧) દારૂ (૨) બીડી પત્તા (૩) જંગલમાંથી કે અન્ય રીતે મેળવેલ લાકડું (૪) જંગલની અન્ય પેદાશો

(૫) ભંગાર એટલે કે ઉત્પાદનમાંથી નીકળતો વેસ્ટેજ અને ભંગાર (૬) મીકેનિક કામકાજ માંથી નીકળતો વેસ્ટેજ અને ભંગાર તથા કોન્ટ્રાક્ટનાં ઘંઘામાંથી નીકળતો ભંગાર (જ્યારે આ ભંગાર મૂળ સ્વરૂપે વાપરી શકાય તેવો હોય નહીં.)

- (૨) ઉપરોક્ત વસ્તુઓનું જ્યારે વેચાણ કરવામાં આવે ત્યારે ખરીદનાર પાસેથી લાગુ પડતા દરે (જેના દર ૧% થી ૫% છે.) TCS વસુલ કરવો પડે અને ભરવો પડે.
- (૩) TDS ની જોગવાઈ માફક જ આ રીતે ઉઘરાવતો TCS સમયસર ભરવો પડે અને તેના ત્રિમાસીક સ્ટેટમેન્ટ પણ સમયસર ભરવા પડે, નહીંતર દંડ થાય.
- (૪) જો ઉપરોક્ત વસ્તુઓનું વેચાણ કરનાર ખરીદનાર પાસેથી TCS ઉઘરાવે નહીં તો ઘરનો ટેક્સ ભરવો પડે.

(૧૨) ઉપરોક્ત TDS/TCS ની જોગવાઈ ઘોને લાગુ પડે :-

- (૧) કંપની, ભાગીદારી પેટ્ટી, ટ્રસ્ટ, ઓડીટ કરાવતી માલિકી પેટ્ટી વિગેરે ને આ જોગવાઈ લાગુ પડે.
- (૨) વ્યક્તિ કે HUF ના ઘંઘાનું ટર્ન ઓવર ઓડીટ ને પાત્ર ન હોય તો નવા વર્ષથી આ જોગવાઈ લાગુ પડે નહીં.

(૧૩) TDS રકમ ભરવાની મુદત :-

- (૧) જે મહિનામાં કપાત કરી હોય તે પછીના મહિના ની ૭ તારીખ સુધીમાં કરેલી કપાતની રકમ ભરી દેવી પડે. દા.ત.:- ૧લી એપ્રિલ અને ૩૦મી એપ્રિલે કપાત કરી હોય તો ૭મી મે સુધીમાં ભરવી પડે.
- (૨) હિસાબી વર્ષ પૂરું થતું હોય ત્યારે વર્ષના છેલ્લા દિવસે TDS કરી હોય તે TDS ની રકમ ૩૦મી એપ્રિલ સુધીમાં ભરવી પડે દા.ત.:- ૩૧મી માર્ચના રોજ વ્યાજ અને ભાડાની રકમ ચુકવી હોય કે જમા કરી હોય તેની કપાત ૩૦મી એપ્રિલ સુધીમાં ભરવી પડે.

(૧૪) TDS કરી હોય તે માટેનું ક્વાર્ટરલી સ્ટેટમેન્ટ :-

- (૧) ગમે તે કલમ હેઠળ TDS કરી હોય તેનું ત્રિમાસીક સ્ટેટમેન્ટ (રીટર્ન) ત્રિમાસીક હપ્તો પુરો થયા પછી ૧૫ દિવસની અંદર E ફાઇલિંગ કરવું ફરજિયાત છે.
- (૨) આપું ત્રિમાસીક સ્ટેટમેન્ટ ૧૫ દિવસની મુદતમાં ભરી ન શકાય તો રોજના રૂા. ૨૦૦/- લેખે દંડ ભરવો પડે અને આ દંડનું ચલણ પહેલા ભરવું પડે જેની વિગત આવા ત્રિમાસીક સ્ટેટમેન્ટમાં લખવામાં આવે પછીજ E ફાઇલિંગ થઈ શકે.
- (૩) TDS કપાત કરનાર સાચી વિગતનું ત્રિમાસીક સ્ટેટમેન્ટ ભરે તોજ જેની કપાત થઈ હોય તેને TDS ની રકમ મજરે મળે, આની કાળજી લેવા માટે જેની TDS થઈ હોય તેમણે ઇન્કમેટેક્સની વેબસાઇટ ઉપરથી તેમના ખાતાનું 26AS સ્ટેટમેન્ટ લેવું પડે અને TDS મેળવવી પડે. જો થયેલી કોઈ TDS ની રકમ 26AS સ્ટેટમેન્ટમાં જમા ન આવતી હોય તો જેણે કપાત કરી હોય તેમનું ધ્યાન દોરીને તેમણે જે ભુલ કરી હોય તે અંગેનું રીવાઈઝ્ડ સ્ટેટમેન્ટ ફાઇલ કરાવવું પડે.
- (૪) ઇન્કમેટેક્સ ખાતું તમારા 26AS સ્ટેટમેન્ટ માં TDS ની જે રકમ બતાવેલ હોય તેનીજ ટેક્સ કેડીટ આપે છે. એટલે જેમની TDS થઈ હોય તેમણે કાળજી લઈ 26AS સ્ટેટમેન્ટ બરોબર મેળવવું પડે.
- (૫) TDS કરનારની ખાસ ફરજ છે કે ત્રિમાસીક સ્ટેટમેન્ટ ભરે ત્યારે TDS ની જે રકમ સામે MIS MATCH આવતું હોય તેની ખુટતી વિગત સુધારી લઈને દરેક TDS સામે MATCHED શબ્દ આવવો જોઈએ કારણ કે TDS ની રકમ સામે Matched લખાઈને આવે તે રકમ તે પાર્ટના 26AS સ્ટેટમેન્ટમાં ઓટોમેટીક જમા થાય છે.
- (૬) જે તે કપાત માટે ફોર્મ 16A કે 16 જે આપવાના છે તે પણ E ફાઇલિંગ કરેલા સ્ટેટમેન્ટ ના આધારે ઇ-મેઈલથી માંગવાના હોય છે. એટલે જેમની TDS થઈ હોય અને આપું 16A કે 16 નંબર નું ફોર્મ મળેલું હોય અને તેમાં Mismatch લખેલું આવે તો ખાસ રસ લઈને TDS કરનાર પાસે રીવાઈઝ્ડ સ્ટેટમેન્ટ ભરાવવું પડે.



(૫)

- (૭) પગાર કપાત કરનારે આવા ત્રિમાસીક સ્ટેટમેન્ટ ફોર્મ નંબર 24Q માં ભરવાના છે અને તેસિવાયની બાકીની બધી કપાતની રકમ માટે ત્રિમાસીક સ્ટેટમેન્ટ ફોર્મ 26Q માં ભરવાનું રહે છે.
- (૮) પગાર કપાતનું છેલ્લું ત્રિમાસીક રીટર્ન 24Q એન્યુઅલ રીટર્ન તરીકે નું ભરવાનું રહેશે.
- (૯) ફોર્મ 24Q કે ફોર્મ 26Q ત્રિમાસીક સ્ટેટમેન્ટ E ફાઇલિંગ થી ભરવાના છે. જેની CD બનાવીને ફોર્મ 27/27A સાથે જરૂરી હી ભરીને ૧૫ દિવસની સમયમર્યાદામાં NSDL કે અન્ય માન્ય એજન્સીમાં ફાઇલ કરવા ફરજિયાત છે.
- (૧૦) છેલ્લાં હપ્તાનું ફોર્મ 24Q/26Q સ્ટેટમેન્ટ તા. ૩૦/૪/૦૧૩ સુધી ભરવાનું રહે છે. એટલે માર્ચ માસની કપાત એપ્રિલમાં પહેલી ભરીને ચલણ સાથે TDS ની વિગતો અમને ૨૦-૪-૨૦૧૩ સુધીમાં આપવી.
- (૧૧) જેની કપાત થઈ હોય તેની પેમેન્ટની રકમ કે TDS ની રકમ કે P.A. નંબર લખવામાં ભુલ થઈ હોય તો મોટા ભાગે Mismatch થાય છે એટલે ત્રિમાસીક સ્ટેટમેન્ટ ભરનારે પુરી કાળજી લઈ એકપણ રકમની Mismatch ન થાય તેવી રીતે ત્રિમાસીક સ્ટેટમેન્ટ ભરવા સલાહ છે.

(૧૫) ઈન્કમેટેક્સના દર :-

- (૧) ગઈ સાલ સુધી પુરૂષ અને સ્ત્રી માટેના શરૂઆતના ટેક્સના દર અલગ અલગ હતાં પણ હવે ચાલુ સાલથી એટલે કે A.Y. 2013-14 થી સ્ત્રી અને પુરૂષ બંને માટે દર સરખા રાખેલા છે.
- (૨) ઈન્કમેટેક્સ નેટ કરપાત્ર આવક ઉપર ભરવાનો થાય છે અને અંગત કે HUF ના કેસમાં બાદ મળવાપાત્ર કપાતો ની રકમ બાદ કર્યા પછી જે રકમ વધે તે કરપાત્ર આવક ગણાય જેના ઉપર લાગુ પડતાં દરેથી ટેક્સ લાગે.
- (૩) ભાગીદારી પેઢીનાં કેસમાં ભાગીદારોની મૂડી ઉપર ૧૨% સુધીની મર્યાદામાં આપેલી વ્યાજની રકમ તથા નિયમ પ્રમાણે વર્કિંગ પાર્ટનરને આપેલો પગાર બાદ કર્યા પછી જે નેટ આવક વધે તે કરપાત્ર આવક ગણાય
- (૪) કરપાત્ર આવક ઉપર ઈન્કમેટેક્સના દર નીચે પ્રમાણે છે.

(૧) વ્યક્તિ (સ્ત્રી કે પુરૂષ) અને HUF ના કેસમાં	ટેક્સનો દર	એજ્યુ. સેસ	(૪) ભાગીદારી પેઢી કે LLP	ટેક્સનો દર	એજ્યુ. સેસ
(૧) શરૂઆતના રૂા. ૨,૦૦,૦૦૦ સુધી	માફી છે.	-	(૧) કોઈ આવક માફ નથી.	-	-
(૨) રૂા. ૨૦૦૦૦૧ થી રૂા. ૫૦૦૦૦૦ સુધી	૧૦ %	૩ %	(૨) તમામ કરપાત્ર આવક ઉપર	૩૦ %	૩ %
(૩) રૂા. ૫૦૦૦૦૧ થી રૂા. ૧૦,૦૦,૦૦૦ સુધી	૨૦ %	૩ %	(૩) LLP તથા પેઢી ના કેસમાં ઈન્કમેટેક્સ કાયદા-પ્રમાણે બાદ મળવાપાત્ર રકમના કારણે નફાની રકમ ઓછી થતી હોય તો નફાની રકમ ઉપર ઓલ્ટરનેટ મીનીમમ ટેક્સ	૧૮.૫ %	૩ %
(૪) રૂા. ૧૦,૦૦,૦૦૧ થી વધુ	૩૦ %	૩ %	(૪) પ્રાઇવેટ કે પબ્લીક લીમિટેડ કંપની	-	-
(૨) ૧૦ વર્ષ થી ૮૦ વર્ષ સુધીના પુરૂષ અને સ્ત્રીના કેસમાં			(૧) કોઈ આવક માફ નથી	-	-
(૧) પ્રથમ રૂા. ૨,૫૦,૦૦૦ સુધી	માફી છે.	-	(૨) તમામ કરપાત્ર આવક ઉપર	૩૦ %	૩ %
(૨) રૂા. ૨,૫૦,૦૦૧ થી રૂા. ૫૦૦૦૦૦ સુધી	૧૦ %	૩ %	(૩) MAT	૧૮.૫ %	૩ %
(૩) રૂા. ૫૦૦૦૦૧ થી રૂા. ૧૦,૦૦,૦૦૦ સુધી	૨૦ %	૩ %	(૪) જો આવક રૂા. ૧ કરોડથી વધુ હોય તો ટેક્સની રકમના ૫% સરચાર્જ લાગે	%	
(૪) રૂા. ૧૦,૦૦,૦૦૧ થી વધુ	૩૦ %	૩ %			
(૩) ૮૦ વર્ષ થી ઉપરના પુરૂષ અને સ્ત્રીના કેસમાં					
(૧) પ્રથમ રૂા. ૫,૦૦,૦૦૦ સુધી	માફી છે.	-			
(૨) રૂા. ૫,૦૦,૦૦૧ થી રૂા. ૧૦,૦૦,૦૦૦ સુધી	૨૦ %	૩ %			
(૩) રૂા. ૧૦,૦૦,૦૦૧ થી વધુ	૩૦ %	૩ %			

નોટ :-

અંગત તથા HUF ને ૨૦ લાખથી વધુ આવક હોય તો MAT લાગુ પડે.



(૬)

(૧૭) કુલ આવકમાંથી બાદ મળવાપાત્ર કપાતો :-

(૧) અંગત સ્ત્રી કે પુરૂષ તથા HUF ના હેસમાં :-

- (૧) વીમો, પી.પી.એફ, બે બાળકો સુધીની સ્કુલ ફી, હાઉસિંગ લોનના ભરેલા હપ્તાની રકમ, NSC વિગેરે મળીને રૂા. ૧,૦૦,૦૦૦/- સુધીની રકમ બાદ મળે છે.
- (૨) મેડીક્લેમની રકમ ભરતા હોય તેમને રૂા. ૧૫૦૦૦/- સુધીની રકમ બાદ મળે છે. અને સીનીયર સીટીઝન આવી મેડીક્લેમની રકમ ભરતા હોય તો રૂા. ૨૦,૦૦૦/- સુધી બાદ મળે છે.
- (૩) ખોડ-ખાંપણ માટે નીચમ પ્રમાણે રૂા. ૫૦,૦૦૦/- કે / ૧૦૦,૦૦૦/- ની રકમ બાદ મળે છે.
- (૪) 80G માફી સર્ટીફિકેટ ધરાવતી સંસ્થાને આપેલા દાનની રકમના ૫૦% રકમ બાદ મળે પણ કુલ આવકના ૧૦% થી વધુ રકમનું દાન આપેલ હોય તો ૧૦% ની મર્યાદામાં કપાત બાદ મળે. આવી દાનની રકમ રૂા. ૧૦ હજાર થી વધુ હોય તો A/C Pay ચેક/ડી.ડી. થી દાન આપેલ હોય તો જ મળે.

(૨) ભાગીદારી પેઠી માટે :-

- (૧) ભાગીદારોની મૂડી ઉપર ભાગીદારી અસ્તાવેજની જોગવાઈ મુજબ ૧૨% સુધીની મર્યાદામાં ભાગીદારોને આપેલ વ્યાજની રકમ બાદ મળે.
- (૨) તેવી જ રીતે ભાગીદારી દસ્તાવેજની જોગવાઈ પ્રમાણે બુક પ્રોફીટની રકમમાંથી નીચે પ્રમાણે પગારની રકમ બાદ મળે.
 - (૧) જો આવક રૂા. ૧,૫૦,૦૦૦/- સુધી હોય તો ૧૦૦% પ્રમાણે
 - (૨) જો આવક રૂા. ૧,૫૦,૦૦૦/- કરતાં વધુ હોય પરંતુ રૂા. ૩,૦૦,૦૦૦/- સુધી હોય તો કુલ આવકના ૯૦% પ્રમાણે
 - (૩) જો આવક રૂા. ૩,૦૦,૦૦૦/- થી વધુ હોય તો આવી વધારાની આવકની રકમના ૬૦% પ્રમાણે

(૧૭) P.A. નંબર (PAN) ની અગત્યતા :-

- (૧) વેપાર, ધંધો કે નોકરી કરતાં હો કે બેંક ખાતું ખોલાવવું હોય કે કોઈ સ્થાવર મિલકત ખરીદવી હોય કે વેચવી હોય કે ઇન્કમેટેક્સ ભરવો હોય કે ફોટો આઈડિન્ટી આપવી હોય તો PAN વગર ચાલે તેમ નથી એટલે કે PAN હોવો જરૂરી અને ફરજિયાત છે.
- (૨) PAN ખોટો લખવામાં આવે તો રૂા. ૧૦,૦૦૦/- નો દંડ થાય તેવી જોગવાઈ છે. માટે PAN સાચો લખવાની કાળજી લેવી. તે માટે PAN નો સીકો બનાવી જરૂર હોય ત્યાં લગાવવો સલાહભર્યું છે.
- (૩) જેમને પોતાને મળતી રકમમાંથી TDS થાવાની હોય તેમણે આવી રકમનું પેમેન્ટ કરનારને PAN ની ઝેરોક્ષ કોપી આપવી જરૂરી છે. જેથી Form 26Q / 24Q ત્રિમાસીક સ્ટેટમેન્ટમાં PAN લખવામાં ભૂલ પડે નહીં.
- (૪) પેમેન્ટ આપનાર તથા પેમેન્ટ લેનાર બંનેએ એક બીજાને મોકલવામાં આવતાં બીલ કે ઇન્વોઈસ કે ખાતાના ઉતારા કે પત્રવ્યવહાર કે દસ્તાવેજો વિગેરેમાં પોતાનો PAN લખવો જરૂરી છે.
- (૫) ટ્રાન્સપોર્ટ નો ધંધો કરનારે ટ્રાન્સપોર્ટ રસીદમાં PAN ઉપાવવો હિતાવહ છે. જેથી TDS થાય નહીં.
- (૬) સમગ્ર રીતે જોઈએ તો PAN આઈડિન્ટીટી નું કામ કરે છે. તે સ્વીકારવું રહ્યું.

(૧૮) TDS ના ત્રિમાસીક સ્ટેટમેન્ટ સમયસર ના ભર્યા હોય તેના માઠા ફળ (જેની TDS થઈ હોય તેમના હેસ માટે) :-

- (૧) જેની TDS થઈ હોય તેની કેડીટ TDS કરનારે ભરેલા ત્રિમાસીક સ્ટેટમેન્ટ 24Q / 26Q ઉપરથી મળશે એટલે TDS કરનારે આવા ત્રિમાસીક સ્ટેટમેન્ટ ભર્યા ના હોય કે તેમાં પુરી વિગત ભરી ન હોય તો TDS ની કેડીટ મળશે નહીં.
- (૨) ઇન્કમેટેક્સ ખાતાની સીસ્ટમ પ્રમાણે TDS કરનારે ભરેલા 26Q / 24Q ત્રિમાસીક સ્ટેટમેન્ટમાં જે PAN લખેલો હોય તે PAN ના ખાતામાં આવી TDS ની રકમ જમા થાય છે.

(૭)

- (૩) TDS ની કેડીટ લેવાની હોય તેમના એસેસમેન્ટ વખતે ઇન્કમેટેક્સ ખાતાની સીસ્ટમ મુજબ જે TDS ની રકમ જમા થઈ હશે તેની જ કેડીટ મળશે.
 - (૪) દરેક PAN ઘરાવનાર પોતાના ખાતામાં જમા થયેલી TDS ની રકમ જાણવી હોય તો ઇન્કમેટેક્સ ખાતાની વેબસાઇટ ઉપરથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને Form 26AS મેળવી શકે છે અને TDS ની જે રકમ જમા આવતી ના હોય તે માટે TDS કરનાર સાથે સંપર્ક કરી ત્રિમાસીક સ્ટેટમેન્ટ જરૂર મુજબ રીવાઈઝ્ડ કરાવીને પોતાના Form 26AS ના ખાતામાં આવી TDS ની રકમ જમા મેળવી શકે છે.
 - (૫) ત્રિમાસીક સ્ટેટમેન્ટ ભરનારે જેની TDS થઈ હોય તેનો PAN સાચો લખવો જરૂરી છે કારણ ખોટો PAN લખાય તો Form 26AS માં આ વિગત આવે નહીં.
 - (૬) TDS કરનાર પાસેથી Form 16-A (પગારની આવક માટે Form No.16) મેળવી લેવું જોઈએ અને આ ફોર્મમાં જે MISMATCH લખેલું હોય તો TDS કરનારે ભરેલા ફોર્મ 24Q / 26Q માં કાંઈક ભૂલ કરેલી છે તેમ સમજવું એટલે તેમનો સંપર્ક કરી જરૂર મુજબ રીવાઈઝ્ડ સ્ટેટમેન્ટ ફાઇલ કરાવવું જોઈએ.
 - (૭) Form 16-A/16 TDS કરનારે 26Q / 24Q ભરેલા સ્ટેટમેન્ટ ઉપરથી જનરેટ થાય છે.
- (૧૯) TDS કપાત ના કરવાથી કે મોડી ભરવાથી થતું આર્થિક નુકશાન :-**
- (૧) TDS કરવાની હોય પણ કરી ના હોય તો અથવા TDS કરી હોય અને સમય મર્યાદામાં ભરી ના હોય તો આવું ખર્ચ બાદ મળે નહીં જેથી આવક તેટલી વધે. અને વધારાનો ટેક્સ ભરવો પડે.
 - (૨) રીટર્ન ભરતાં પહેલાં પૂરી ચોકસાઈ કરી કોઈ TDS ની રકમ કરવાની રહી ગઈ હોય કે ભરવાની રહી ગઈ હોય તો રીટર્ન ભરવાની તારીખ પહેલાં વ્યાજ સાથે ભરી દેવાથી આવું ખર્ચ આવકમાં ઉમેરાશે નહીં.
 - (૩) રીટર્ન ભરવાની તારીખ એટલે ઓડીટ ના કરાવતી પેઢીઓ મુજબે ૩૧મી જુલાઈ અને ઓડીટ કરાવતી પેઢીઓ માટે ૩૦મી સપ્ટેમ્બર સમજવી.
- (૨૦) ફરજિયાત ઓડીટ - કલમ 44AB :-**
- (૧) વેપાર ધંધો કરતાં દરેકે જે તેમનું ટર્ન ઓવર (ખરીદ કે વેચાણ) રૂા. ૧ કરોડ થી વધુ હોય તો હિસાબી ચોપડા ઓડીટ કરાવવા ફરજિયાત છે.
 - (૨) પ્રોફેશન કરતાં દરેકે એટલે કે વકીલ, એન્જનીયર, ડૉક્ટર, C.A વિગેરે પ્રોફેશનલ સર્વિસ આપનારે વર્ષ દરમિયાન કુલ રીસીપ્ટ્સ રૂા. ૨૫ લાખથી વધુ હોય તો ઓડીટ કરાવવું ફરજિયાત છે.
 - (૩) કુલ ટર્ન ઓવર રૂા. ૧ કરોડ થી ઓછું હોય તો ૮% લેખે નફો બતાવવો જોઈએ પણ જે આ રીતે નફો ૮% થી ઓછો હોય અને ટેક્સેબલ આવક હોય તો ઓડીટ ફરજિયાત છે. કારણ કે ઓડીટ કરાવેલ હોય તો જ ૮% થી ઓછા નફાનું રીટર્ન ભરી શકાય.
 - (૪) ઓડીટ કરાવવું ફરજિયાત હોય અને ઓડીટ કરાવવામાં ના આવે તો રૂા. ૧,૫૦,૦૦૦/- સુધીના દંડ થાય.
- (૨૧) રૂા. ૧ કરોડ થી ઓછું ટર્ન ઓવર હોય તો ૮% નફાની જોગવાઈ - કલમ 44AD :-**
- (૧) અંત કે એચ.યુ.એફ. કે ભાગીદારી પેઢી વેપાર ધંધો કરતાં હોય તો લાગુ પડે.
 - (૨) રીસેલર કે હોલસેલર કે મેન્યુફેક્ચરર બધા ને લાગુ પડે. પરંતુ પ્રોફેશનલ પર્સન, કમીશન એજન્ટ, બ્રોકર તથા એજન્ટી બીઝનેસને લાગુ ના પડે.
 - (૩) ધંધાનું ટર્ન ઓવર રૂા. ૧ કરોડ થી ઓછું હોય તેમણે ૮% પ્રમાણે નેટ નફો ગણી ઇન્કમેટેક્સ ભરવો પડે.
 - (૪) ભાગીદારી પેઢી માટે આવી ૮% ની રકમ માંથી ભાગીદારોની મૂડી નું વ્યાજ તથા વર્કિંગ પાર્ટનર નો પગાર બાદ મળવાપાત્ર છે.
 - (૫) આ રીતે નફાની જે રકમ નક્કી થાય તેમાંથી વિમો વિગેરે રૂા. ૧ લાખ સુધીની કપાત તથા મેડીક્લેમ અને ડોનેશનની રકમ વિગેરે બાદ મળવાપાત્ર કપાત ની રકમ બાદ મળશે.
 - (૬) આવા વેપારીઓને એડવાન્સટેક્સ ભરવા માંથી મુક્તિ આપી છે.
 - (૭) જે વેપારીઓને કુલ ટર્ન ઓવર ના ૮% પ્રમાણે નેટ નફો થતો હોય, અને તેમને રીટર્નમાં ૮% પ્રમાણે ની આવકનો ઇન્કમેટેક્સ ભરવો ન હોય તેમણે તેમનું ટર્ન ઓવર રૂા. ૧ કરોડ થી વધારે ન હોય તો પણ



ફરજિયાત હિસાબોનું ઓડીટ કરાવી રીટર્ન ભરવાની તારીખ પહેલાં ઓડીટ રીપોર્ટ મેળવીને કોન્ટ્રોલ સીગ્નેચરથી રીટર્ન નું ઇ-ફાઇલીંગ કરવાનું રહે.

(૨૨) ધંધા માં વપરાતી મિલકત ના ઘસારાના દર નીચે મુજબ છે :-

- (૧) (૧) મકાન / બિલ્ડિંગ ૧૦% (૨) પ્લાન્ટ અને મશીનરી ૧૫% (૩) ફર્નિચર એન્ડ ડેક સ્ટોક ૧૦% (૪) ટ્રાન્સપોર્ટનાં ધંધા માં વપરાતી ટ્રક ૩૦% (૫) કમ્પ્યુટર તથા સોફ્ટવેર ૬૦%
- (૨) ઉત્પાદન માટે વપરાતા નવા પ્લાન્ટ અને મશીનરી ઉપર ૨૦% લેખે વધારાનો ઘસારો બાદ મળવાપાત્ર છે.
- (૩) જે મિલકત ધંધા માટે ૧૮૦ દિવસ થી ઓછા સમય માટે વાપરવામાં લીધી હોય તેના ઉપર ઘસારાનો દર તથા વધારાનો ઘસારાનો દર અકલ્પ્ય થાય છે.

(૨૩) ઇન્કમેટેક્સ રીટર્ન ભરવાની મુદત :-

- (૧) જે વેપારીઓને ફરજિયાત ઓડીટ કરાવવું જરૂરી નથી તેમના કેસમાં તારીખ ૩૧-૭-૨૦૧૩ સુધીમાં રીટર્ન ભરવું જરૂરી છે.
- (૨) જે વેપારીઓને ફરજિયાત ઓડીટ કરાવવું જરૂરી છે. તેમણે તારીખ ૩૦-૯-૨૦૧૩ સુધીમાં રીટર્ન ભરવું જરૂરી છે.
- (૨A) જે વેપારીઓને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે કલમ 92-E હેઠળ ઓડીટ રીપોર્ટ મેળવવાનો હોય તેમણે તારીખ ૩૦-૧૧-૨૦૧૩ સુધીમાં રીટર્ન ભરવું જરૂરી છે.
- (૩) જે વેપારીઓને નેટ નુકશાન હોય અને સમયસર રીટર્ન ભરે નહીં તો આપું નુકશાન પછીના વર્ષોમાં આગળ ખેંચી શકાશે નહીં.
- (૪) ટેક્સેબલ આવક હોય અને નાણાંકીય વર્ષ પુર થાય ત્યાં સુધીમાં રીટર્ન ભરવામાં ના આવે તો ટંડ થાય એટલે સમયસર રીટર્ન ભરવું છે.
- (૫) એટલે સને ૨૦૧૧-૧૨ (A.Y. 2012-13) ના રીટર્ન જેમના ભરવાના બાકી હોય તેમણે તારીખ ૩૧-૩-૨૦૧૩ પહેલાં રીટર્ન ભરાવી દેવા નહીંતર ટંડ થાય.

(૨૪) રીટર્ન નું ફરજિયાત E ફાઇલીંગ :-

- (૧) જે વેપારીઓ ફરજિયાત ઓડીટ કરાવતા હોય તેમણે E ફાઇલીંગ ડીજીટલ સીગ્નેચર થી કરવું ફરજિયાત છે.
- (૨) દરેક કંપનીએ પણ E ફાઇલીંગ થી રીટર્ન ભરવું ફરજિયાત છે.
- (૩) જેમને ફરજિયાત E ફાઇલીંગ રીટર્ન લાગું પડતું ના હોય તેઓ (ટ્રસ્ટ સિવાયના) મરજિયાત રીતે E ફાઇલીંગ થી રીટર્ન ભરી શકે.

(૨૫) ટેક્સ ફી આવક મેળવવા માટે કરેલા ખર્ચ :-

- (૧) કંપની માંથી મળતું ડીવીડન્ડ તથા મ્યુચ્યુઅલ ફંડ ના રોકાણમાંથી મળતી આવક ટેક્સ ફી છે. અને આ આવક મેળવવા માટે જે ખર્ચ કરેલા હોય તે બાદ મળે નહીં.
- (૨) STT પાત્ર શેરો કે મ્યુચ્યુઅલ ફંડ ખરીદ તારીખના ૧૨ મહિના પછી વેચાણ થાય તો લોંગ ટર્મ કેપીટલ-ગેઇન ટેક્સ લાગતો નથી. એટલે આ આવક અંગે પણ જે ખર્ચો થયા હોય તે બાદ મળે નહીં.
- (૩) સામાન્ય રીતે આવી ટેક્સ ફી આવકના ખર્ચમાં વ્યાજનો ખર્ચ હોય છે. અન્ય ખર્ચ હોય તે પ્રપોર્શનેટ (સરાસરી પ્રમાણે) ગણાશે.
- (૪) એટલે આ રીતે જે ખર્ચ બાદ મળવાપાત્ર ન હોય તે ખર્ચ રીટર્ન ભરતી વખતે ના મંજૂર કરવો જોઈએ.

(૨૬) મિલકત ભાડાની આવક :-

- (૧) રહેવાનું એક મકાન માફ છે. પણ જો એકથી વધારે રહેવાના મકાન હોય તો બીજા મકાનો માટે એન્યુઅલ વેલ્યુની રકમ આવક ગણાશે.
- (૨) એન્યુઅલ વેલ્યુની રકમ નક્કી કરવા માટે મ્યુનિસિપલ ટેક્સ માટે થયેલી ભાડા આકારણીની રકમ અને મિલકત ભાડે આપી હોય તો ભાડાની રકમ એ બે માંથી જે વધુ હોય તે એન્યુઅલ વેલ્યુ ગણાય.
- (૩) દુકાન/ઓફીસ કે ગોડાઉન ધંધા માટે વપરાતા ના હોય અને ભાડે આપેલા ના હોય અને ખાલી હોય તો તેવી મિલકતની 'એન્યુઅલ વેલ્યુ' આવક ગણાય.

(૯)

(૪) મિલકત ભાડાની જે આવક થાય તેમાંથી ૩૦% રકમ બાદ મળે છે. ઉપરાંત મ્યુનિસિપલ ટેક્સની ભરેલી રકમ તથા હાઉસિંગ લોન ઉપર રૂા. ૧,૫૦,૦૦૦/- સુધી ભરેલું વ્યાજ બાદ મળે છે.

(૫) કોઈપણ મકાનના મેઈન્ટેનન્સની રકમ ભરેલી હોય તો તેવી કોઈ રકમ બાદ મળતી નથી.

(૨૭) કેપીટલ ગેઈન-મૂડી-મિલકત નો નફો (લોંગ ટર્મ) :-

- (૧) કંપનીના ઈક્વીટી શેરનું ખરીદ કર્યાના બાર મહિના પછી વેચાણ થાય અને આવા વેચાણ ઉપર જો STT (સીક્યોરીટી ટ્રાન્ઝેક્શન ટેક્સ) લાગેલ હોય તો જે નફો થાય તે લોંગ ટર્મ કેપીટલ ગેઈન તરીકે માફ છે.
- (૨) લીસ્ટેડ કંપનીના શેર, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ કે અન્ય લીસ્ટેડ સીક્યોરીટીનું ખરીદ કર્યાના બાર મહિના પછી વેચાણ થાય પરંતુ તેના ઉપર જો STT લાગેલ ન હોય તો તેવા નફા ઉપર (મૂળ કિંમત બાદ કર્યા પછી) ૧૦% પ્રમાણે લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્સ લાગે.
- (૩) સ્થાયર કે અન્ય જંગમ મિલકત ખરીદી ની તારીખથી ૩૬ મહિના પછી વેચવા માં આવે તો ઈન્ડેક્સ કોસ્ટ બાદ કરતાં જે નફો રહે તેના ઉપર લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્સ લાગે.
- (૪) લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્સનો દર ૨૦% છે. અને ટેક્સની જે રકમ થાય તેના ઉપર ૩% એજ્યુકેશન શેસ લાગે.
- (૫) લોંગ ટર્મ કેપીટલ ગેઈનના નફાની રકમ રૂા. ૫૦ લાખ સુધીની છ માસની અંદર કેપીટલ બોન્ડ માં રોકાણ કરવામાં આવે તો કેપીટલ ગેઈન ટેક્સ લાગે નહીં.
- (૬) મિલકત વેચાણના ૧ વર્ષ પહેલાં કે વેચાણ પછી બે વર્ષમાં મિલકતના વેચાણની રકમ જેટલું રોકાણ નવા રહેવાના મકાનની ખરીદીમાં કરવામાં આવે કે ૩ વર્ષમાં રહેવાનું નવું મકાન બનાવવામાં આવે તો લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્સ લાગે નહીં. આ અંગે વેપારી ભાઈઓએ રૂબરૂ મલવું.

(૨૮) કેપીટલ ગેઈન-મૂડી-મિલકત નો નફો (શોર્ટ ટર્મ) :-

- (૧) જેના વેચાણ ઉપર STT ટેક્સ લાગેલો હોય તેવા ઈક્વીટી શેર કે યુનિટ ખરીદીની તારીખ થી ૧૨ મહિના ની અંદર વેચવામાં આવે તો શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ટેક્સ ૧૫% લાગે અને ટેક્સ ની રકમના ૩% એજ્યુકેશન શેસ લાગે.
- (૨) જે કંપની ના શેર / યુનિટ ઉપર STT ટેક્સ લાગેલો ના હોય તેવા વેચાણ નો નફો કુલ આવક માં ગણાય અને લાગુ પડતા દરે ટેક્સ લાગે.
- (૩) નવી કંપનીના ઈસ્યુ ભરવાનું કે બજારમાંથી શેર ખરીદવા વેચવાનું પારંપાર બનતું હોય તો ઈન્વેસ્ટમેન્ટ નહીં ગણાતાં ધંધાની આવક ગણાય તેવું ઈન્કમેટેક્સ ખાતાનું માનવું છે.
- (૪) અન્ય સ્થાયર કે જંગમ મિલકત ખરીદી ની તારીખ થી ૩૬ મહિના પહેલા વેચવામાં આવે તો જે નફો થાય તેના ઉપર રૂટીન દરે ઈન્કમેટેક્સ લાગે.

(૨૯) મળેલી બક્ષીસ ઉપર ભરવાનો ઈન્કમેટેક્સ :-

- (૧) નક્કી કરેલા સગા શિવાયની વ્યક્તિ કે HUF પાસેથી વર્ષ દરમ્યાન રૂા. ૫૦,૦૦૦/- સુધી મળેલી બક્ષીસની રકમ માફ છે. પણ જો વર્ષ દરમ્યાન મળેલી બક્ષીસ ની રકમ રૂા. ૫૦,૦૦૦/- થી વધુ હોય તો કોઈ રકમ માફ નથી એટલે આવી બક્ષીસની બધી રકમ આવકમાં ઉમેરાય.
- (૨) લગ્ન પ્રસંગે કે વીલ હેઠળ બક્ષીસની રકમ ગમે તેટલી મળી હોય તે માફ છે.
- (૩) નીચેના સગા પાસેથી મળેલી ગમે તેટલી બક્ષીસની રકમ માફ છે. :-

(૧) માતા-પિતા (૨) દાદા-દાદી (૩) પરદાદા-પરદાદી (૪) સાસુ-સસરા (૫) વડસાસુ-વડસસરા (૬) ભાઈ-ભાભી (૭) બેન-બનેવી (૮) સાળા-સાળા ની વહુ (૯) સાળી-સાકુ (૧૦) કાકા-કાકી (૧૧) કઈબા-કુઆ (૧૨) મામા-મામી (૧૩) માસા-માસી (૧૪) પુત્ર-પુત્રવધુ (૧૫) દીકરી-જમાઈ (૧૬) દેરાણી-જેઠાણી (૧૭) દીયર-ભોજાઈ (૧૮) નણંદ-નણદોચા (૧૯) જેઠ

નોંધ :- ઉપરના સગામાં (૧) કાકાજી-કાકીજી (૨) કઈજી-કુવાજી (૩) મામાજી-મામીજી (૪) માસાજી-માસીજીનો સમાવેશ થાય છે કે નહીં તેનો મતભેદ ચાલે છે. એટલે આ સગાઓ પાસે થી બક્ષીસ લેવી નહીં તે હિતાવહ છે.

- (૪) પતિ-પત્નિ એ એક બીજાને તથા સાસુ-સસરા એ પુત્રવધુ ને આપેલી બક્ષીસ ની રકમ માંથી થતી આવક બક્ષીસ આપનારની આવકમાં ઉમેરાય છે. તેથી તેવી ગીફ્ટ આપવી-લેવી સલાહભર્યું નથી.
- (૫) સ્થાયર મિલકત, શેર, હીરા, મોતી, ઝવેરાત, બુલિયન, ફોઈંગ, પેઈન્ટીંગ વિગેરે ની રૂા. ૫૦,૦૦૦/- થી વધુ કિંમતની બક્ષીસ સ્વીકારવામાં આવે તે આવક ગણાશે (ઉપર લખેલા સગા સિવાયના પાસેથી)
- (૬) રોકડ અને જંગમ વિગેરે મિલકતની વર્ષ દરમ્યાન મળેલી બધી બક્ષીસની રકમ રૂા. ૫૦,૦૦૦/- ની મર્યાદામાં ભેગી ગણાય.

(૩૦) ટેક્સનું E પેમેન્ટ :-

- (૧) કંપની, ઓડીટ કરાવતી ભાગીદારી પેટ્ટી, ઓડીટ કરાવતી વ્યક્તિ/ H.U.F. પેટ્ટી વિગેરે એ TDS ની રકમ કે એડવાન્સટેક્સ કે અન્ય ઇન્કમેટેક્સની કોઈપણ રકમ ભરવાની હોય તેનું E પેમેન્ટ કરવું ફરજિયાત છે.
- (૨) જમાનો E ટેકનોલોજીનો છે. એટલે ઉપર પ્રમાણે E પેમેન્ટ કરવું ફરજિયાત ન હોય તો પણ E પેમેન્ટ થી ટેક્સ ભરવા સલાહ છે. કારણ બેંકમાં જાવાનું રહે નહીં અને બેંક વાળા ચલણ ઉપર જે સિક્કા મારે છે તે સ્પષ્ટ વાંચી શકાય તેવા ઓછા હોય છે.

(૩૧) આટલું કરશો નહીં :-

- (૧) માલની ખરીદી કે ઘંઘા અંગેના ખર્ચા નું રૂા. ૨૦,૦૦૦/- થી વધુ રકમ નું પેમેન્ટ એકાઉન્ટ પર ચેક કે ડી.ડી. સિવાય કરવું નહીં નહીંતર ખર્ચ તરીકે બાદ મળશે નહીં.
- (૨) માલની ખરીદી અને ઘંઘા અંગેના ખર્ચાનું રૂા. ૨૦,૦૦૦/- થી વધુ રકમનું પેમેન્ટ વેચનાર વેપારીના બેંક ખાતામાં રોકડે થી ભરવામાં આવે તો આવુ પેમેન્ટ રોકડામાં કર્યાનું ગણાય તેવો વિવાદ શરૂ થયો છે. એટલે આ સંજોગોમાં વેચનારના ખાતામાં રોકડ રકમ ન ભરતા એકાઉન્ટ પેઈ, ડી.ડી. કે પેઈ-ઓર્ડર થી જ રકમ ભરવી હિતાવહ છે.
- (૩) રૂા. ૨૦,૦૦૦/- થી વધુ રકમની લોન કે ડીપોઝીટ એકાઉન્ટ પેઈ-ચેક/ડી.ડી. સિવાય લેવી નહીં.
- (૪) જે ખાતામાં લોન કે ડીપોઝીટની રકમ રૂા. ૨૦,૦૦૦/- થી ઓછી હોય પણ નવી રકમ લેવાથી ખાતાની કુલ રકમ રૂા. ૨૦,૦૦૦/- થી વધુ થાતી હોય તો તે એકાઉન્ટ પેઈ ચેક/ડી.ડી. સિવાય લેવી નહીં.
- (૫) જે ખાતામાં રૂા. ૨૦,૦૦૦/- થી વધુ લોન/ડીપોઝીટ જમા હોય તે ખાતામાંથી એકાઉન્ટ પર ચેક /ડી.ડી. સિવાય એક રૂપિયા નું પણ પેમેન્ટ રોકડે થી કે હવાલા થી કરી શકાય નહીં.
- (૬) એકજ ટ્રાન્સપોર્ટર ને માલના ટ્રાન્સપોર્ટેશન માટે રૂા. ૩૫,૦૦૦/- થી વધુ રકમનું પેમેન્ટ એકાઉન્ટ પેઈ ચેક/ ડી.ડી. સિવાય કરવું નહીં, નહીંતર ખર્ચ તરીકે બાદ મળશે નહીં.
- (૭) ઉપર ૩ થી ૫ માં જે જોગવાઈ છે. તેનો ભંગ કરવા માટે આખી રકમની પેનલ્ટી થાય જેમ કે રૂા. ૨૦,૦૦૦/- ઉપરના કોઈ ખાતામાં રૂા. ૨૫ કે રૂા. ૨૫ લાખ રોકડા જમા લેવામાં આવે તો રૂા. ૨૫ કે રૂા. ૨૫ લાખ ની પેનલ્ટી થાય અને તેવી જ રીતે આવા ખાતામાંથી રોકડે થી જે પેમેન્ટ કરવામાં આવે તેની પણ તેટલી રકમની પેનલ્ટી થાય.

(૩૨) આવકમાંથી બાદ મળવાપાત્ર કપાત રીટર્નમાં કલેઈમ કરવામાં ના આવે તેના પરિણામો :-

- (૧) આવકમાંથી બાદ મળતી રકમો જેવી કે LIP / PPF / NSC / મેડીકલ ઇન્સ્યુરન્સ / ડોનેશન / બાળકોની સ્કુલ ફી વિગેરે કપાતો જે રીટર્નમાં બાદ માંગવામાં ના આવે તો બાદ મળશે નહીં.
- (૨) એટલે રીટર્ન ભરતી વખતે બાદ મળવાપાત્ર રકમ ચોક્કસાઈપૂર્વક બાદ માંગવી જરૂરી છે.
- (૩) કદાચ કોઈ કારણસર આવી કોઈપણ રકમ બાદ લેવી રહી ગઈ હોય તો તાત્કાલિક ટાઈમસર રીવાઈઝડ રીટર્ન ભરી બાદ માંગી શકાય.

(૩૩) ભરેલ ટેક્સ તથા TDS રીટર્ન માં કલેઈમ કરવામાં ન આવે તેના પરિણામો :-

- (૧) ભરેલો એડવાન્સટેક્સ તથા જે TDS થઈ હોય તે રકમ રીટર્નમાં બતાવવામાં ના આવે (કલેઈમ કરવામાં ન આવે) તો તેની કેડીટ મળે નહીં.
- (૨) એટલે કદાચ આવી કેડીટ લેવી રહી ગઈ હોય તો ટાઈમસર રીવાઈઝડ રીટર્ન ભરવું જોઈએ.

(૩૪) રીવાઈઝડ રીટર્ન ભરવાની મુદત :-

- (૧) જે રીટર્ન ભરેલું હોય તેમાં પ્રમાણિક પણે કોઈ ભૂલચુક થઈ હોય કે કોઈ આવક બતાવવી રહી ગઈ હોય કે કોઈ ડીડક્શન ક્લેઈમ કરવા રહી ગયા હોય તો જે તે આકારણી વર્ષ પુરૂ થયાના એક વર્ષમાં કે આકારણી પૂર્ણ થાય તે બે માંથી જે વહેલું હોય તે પહેલાં ભરી શકાય.
- (૨) કદાચ કોઈ કારણસર શુદ્ધ બુદ્ધિથી આપું રીટર્ન સમયસર રીવાઈઝડ ના કરી શકાય તો જ્યારે ખબર પડે ત્યારે તુરંત જ આપું રીટર્ન રીવાઈઝડ કરવું સલાહભર્યું છે. જેથી શુદ્ધ બુદ્ધિ નું વર્તન ટેખાડી શકાય.
- (૩) ઓરીજનલ રીટર્ન જો ટાઈમસર ભરેલ ન હોય તો રીવાઈઝડ રીટર્ન ઇનવેલીડ ગણાય.

(૩૫) વેટ (વેલ્યુ એડેડ ટેક્સ) :-

(૧) પત્રક ભરવાની મુદત :-

- (૧) જે વેપારીઓને ઇ-ફાઈલિંગ થી રીટર્ન ભરવાનું હોય તેમણે લાગુ પડતો માસીક કે ત્રિમાસીક હમો પૂરો થયા પછી ૬૦ દિવસ ની અંદર ભરવું પડે.
- (૨) જે વેપારીઓને ઇ-ફાઈલિંગ થી રીટર્ન ભરવું ફરજિયાત ના હોય અને પેપર રીટર્ન ભરવાનું હોય તેમણે જે તે માસીક હમો કે ત્રિમાસીક હમો પૂરો થયા પછી ૩૦ દિવસની અંદર પેપર રીટર્ન ભરવું ફરજિયાત છે.

(૨) માસીક રીટર્ન કોણે ભરવું પડે :-

જે વેપારીઓને :- (૧) પેટ્રોલપંપનો ઇંધો હોય (૨) ઇમ્પોર્ટ/એક્સપોર્ટ નો ઇંધો હોય (૩) ઉત્પાદક હોય અને ગત વર્ષમાં કે ચાલુ વર્ષમાં રૂ. ૬૦૦૦૦/- થી વધુ ટેક્સ ભર્યો હોય (૪) આંતરરાજ્ય ખરીદી કે વેચાણ કરતા હોય અને રૂ. ૬૦૦૦૦/- થી વધુ ટેક્સ ભર્યો હોય (૫) માલ જાંગડ વેચાણ મોકલતા હોય અને વર્ષ દરમ્યાન રૂ. ૬૦૦૦૦/- થી વધુ ટેક્સ ભર્યો હોય (૬) કપાસીયા ખોળ નું ખરીદ કે વેચાણ કરતા હોય.

(૩) ટેક્સ ભરવાની મુદત :-

- (૧) ગત વર્ષ કે ચાલુ વર્ષ રૂ. ૬૦૦૦૦/- થી વધુ ટેક્સ ભરેલો હોય તેમણે દરેક મહીના નો ટેક્સ જે તે મહીના પછીના મહીનાની ૨૨ મી તારીખ સુધીમાં ભરવો પડે.
- (૨) જે વેપારીઓને માસીક રીટર્ન ભરવાનું હોય તેમણે પણ મહીનો પૂરો થયા પછી પછીના મહીના ની ૨૨મી તારીખ સુધીમાં ટેક્સ ભરવો પડે.
- (૩) જે વેપારીઓ એ ગત વર્ષમાં કે ચાલુ વર્ષમાં રૂ. ૬૦૦૦૦/- થી ઓછો ટેક્સ ભરેલો હોય તેમણે ત્રિમાસિક ટેક્સ ભરવો પડે એટલે ૩૦ મી જૂન, ૩૦મી સપ્ટેમ્બર, ૩૧મી ડીસેમ્બર અને ૩૧મી માર્ચ નો જે તે હમો પૂરો થયા પછી ૨૨ દિવસ ની અંદર ટેક્સનું ચલણ ભરવું પડે.

(૪) માસીક કે ત્રિમાસીક ઇ-રીટર્ન ભરવા માટે આપવાની વિગત :-

- (૧) લેટરપેડમાં કુલ ખરીદી/બુલ વેચાણના આંકડા
- (૨) સ્ટોક સ્ટેટમેન્ટ Form 201-C લેટરપેડ ઉપર તથા CD માં અથવા e-mail થી.
- (૩) ટેક્સ ઇન્વોઈસથી કરેલી ખરીદી તથા વેચાણની વિગત CD માં અથવા e-mail થી.
- (૪) ભરેલું ટેક્સનું અસલ ચલણ તથા ૧ એરોક્ષ કોપી.
- (૫) આંતરરાજ્ય વેચાણ કરેલું હોય તો તેની વિગત CD માં અથવા e-mail થી.
- (૬) આંતરરાજ્ય ખરીદી કરી હોય તો તેની વિગત CD માં અથવા e-mail થી.
- (૭) 'F' ફોર્મ કે 'G' ફોર્મ થી ખરીદ-વેચાણ ની વિગત CD માં અથવા e-mail થી.

(૫) વેટ રીટર્ન નું ઇ-ફાઈલિંગ :-

- (૧) જે વેપારીઓ CST નોંધણી નંબર ધરાવતા હોય તેમણે ફરજિયાત વેટ તથા CST કાચદાના રીટર્ન ઇ-ફાઈલિંગથી ભરવા પડે પછી ભલે તેમનું ટર્ન ઓવર રૂ. ૫૦ લાખથી ઓછું હોય.
- (૨) જે વેપારીઓ CST નંબર ધરાવતા ના હોય પરંતુ વાર્ષિક ટર્ન ઓવર રૂ. ૫૦ લાખથી વધુ હોય તેવા વેપારીઓએ પણ રીટર્નનું ઇ-ફાઈલિંગ કરવાનું છે.

(૧૨)

- (૩) નીચેની વસ્તુઓનો વેપાર કરતાં વેપારીઓ કે જેમણે CST નંબર ના હોય અને તેમનું ટર્ન ઓવર રૂ. ૫૦ લાખ થી ઓછું હોય તો પણ રીટર્ન નું ઇ-ફાઇલિંગ કરવું પડે.
(૧) ટીમ્બર-લાઇકું (૨) સીરામીક ટાઇલ્સ (૩) લોખંડનો ભંગાર અને (૪) તમાકુ અને તમાકુ પ્રોડક્ટ્સ (અન મેન્યુફેક્ચર્ડ તમાકુ સિવાય)
- (૪) વર્ષ દરમિયાન ટર્ન ઓવર રૂ. ૫૦ લાખથી ઓછું હોય તો જ્યારે ટર્ન ઓવર રૂ. ૫૦ લાખ થી વધુ થાય ત્યારથી રીટર્નનું ઇ-ફાઇલિંગ કરવું પડે.
- (૫) ઉપર જણાવેલા વેપારીઓએ માત્ર અને માત્ર ઇ-ફાઇલિંગ થી રીટર્ન ભરવું ફરજિયાત છે એટલે પેપર રીટર્ન ભરી શકાતું નથી.
- (૬) ઉપર જણાવેલ વેપારીઓને જો માસિક રીટર્ન ભરવાની જોગવાઈ લાગુ પડતી હોય તો માસિક રીટર્ન પણ ઇ-ફાઇલિંગ થી ભરવું ફરજિયાત છે.
- (૭) ઇ-ફાઇલિંગ થી રીટર્ન ભરવું ખૂબ ટાઇમ લાગે તેવું કામ છે. જેથી ખર્ચ વધે છે. એટલે જે વેપારીઓને CST નંબરની જરૂર ના હોય તેમણે CST નંબર રદ કરાવી નાંખવો સલાહભર્યું છે.

(૬) સમયસર રીટર્ન ના ભરવાના ગેર ફાયદા :-

- (૧) જે વેપારીઓ પેપર રીટર્ન કે ઇ-ફાઇલિંગ થી રીટર્ન ભરવાનું હોય છતાં ના ભરે તો નિયમ પ્રમાણે દંડ થાય.
- (૨) એક રીટર્ન મોકું ભરવા માટે વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- સુધીની પેનલ્ટી થઈ શકે છે.
- (૩) સતત ૩ રીટર્ન નું ઇ-ફાઇલિંગ કરવામાં ના આવે તો વેટ કાયદા હેઠળનો TIN નંબર રદ થઈ શકે.
- (૪) વેપારીને 'C' ફોર્મ કે 'H' ફોર્મ કે 'F' ફોર્મ કે ફોર્મ નં. ૪૦૨ કે ફોર્મ નં. ૪૦૩ મેળવવાના હોય તો મળે નહિ.
- (૫) એટલે વેટ કાયદાના પત્રકો સમયસર નિયમ પ્રમાણે ભરવા સલાહ છે.

(૭) સને ૨૦૧૨-૧૩ નું વાર્ષિક વેટ પત્રક :-

- (૧) તારીખ ૩૦-૬-૨૦૧૩ સુધીમાં ભરવું પડે. ઓડીટ કરાયતા વેપારીઓએ તા. ૩૧/૧૨/૨૦૧૩ સુધીમાં ભરવાનું છે.
- (૨) વાર્ષિક રીટર્ન ભરવા માટે,
(૧) ખરીદ પત્રકે થી હસાવાર ખરીદી (૨) વેચાણ પત્રકે થી હસાવાર વેચાણ (૩) VAT, CST, INPUT તથા OUTPUT ના ટેક્ષખાતા (૪) ભરેલા ચલણોની ઝેરોક્ષ (૫) ચોપડા ઉપરથી ખાતાવાર કુલ ખરીદી અને કુલ વેચાણ વિગેરે વિગતો વહેલાસર મોકલશો જેથી સમયસર વાર્ષિક રીટર્ન ભરી શકાય.

(૮) સને ૨૦૧૨-૧૩ નું વેટ ઓડીટ :-

- (૧) સને ૨૦૧૨-૧૩ ના વર્ષ દરમિયાન પોતાના વેપાર ખાતાનું તથા કમીશન નું તથા ઉત્પાદનનું કે આ ત્રણેય મળીને કુલ ટર્ન ઓવર રૂ. ૧ કરોડ થી વધારે હોય તો ચોપડા ઓડીટ કરાવી વેટ ઓડીટ રીપોર્ટ તારીખ ૩૧-૧૨-૨૦૧૩ સુધીમાં વેટ કચેરીમાં રજુ કરવો ફરજિયાત છે.
- (૨) વેટ ઓડીટ રીપોર્ટ મોકી રજુ કરવામાં આવે તો રૂ. ૧૦૦૦૦/- દંડ થાય છે.
- (૩) વેટ ઓડીટ કરાવવા માટે રૂબરૂ સંપર્ક કરવો.

(૯) વેટ Form 402/403 (તારીખ ૦૧/૦૫/૨૦૧૨ થી ફરજિયાત) :-

- (૧) જીરૂ વરીયાળી, ઇસબગુલ, તેલીબીયા, ખાદ્ય તેલો, લોખંડ, ડી ઓઇલ કેક, ઘાસ પાર્ટ્સ, સીરામીક પ્રોડક્ટ્સ ગુજરાત રાજ્ય બહાર વેચવામાં આવે તો ટેક્સ વેચાણ બીલનું Form 402 ઇ-મેઇલ થી ઓન લોઇન લેવાનું ફરજિયાત કરેલ છે.
- (૨) સીમેન્ટ, ચા કોફી, લોખંડ, કોટા સ્ટોન, મારબલ, ટ્રેનાઇટ, તમામ વાહનો, પ્લાયવુડ, ફોરમાઇડા ની ગુજરાત રાજ્ય બહાર થી ખરીદી કરવી હોય તો તે અંગે નું Form 403 ઇ-મેઇલ થી ખાતાની વેબસાઇટથી ઓનલાઇન માંગણી કરીને મેળવવાનું ફરજિયાત કરેલ છે.

- (૩) એટલે કે ટરેક વેપારી એ પોતાની મેળે ઓન લાઇન ફોર્મ-૪૦૨/૪૦૩ લેવાનું શીખી લેવું જરૂરી છે. આ માટે કોમ્પ્યુટર જાણતા વેપારીઓએ પોતે કે તેમના એકાઉન્ટન્ટે અમારો રૂબરૂ સંપર્ક કરવો. જેથી સદર ફોર્મ ઓન લાઇન લેવાની પ્રોસીજર શીખવાડી શકાય.
- (૪) ઉપર લખ્યા મુજબની ચીજવસ્તુઓ સિવાય ની અન્ય તમામ ચીજવસ્તુઓ માટેના Form 402/403 વેપારી પોતે પ્રીન્ટ કરીને કે બજારમાંથી તૈયાર મેળવીને વાપરી શકે છે. પરંતુ આવા ફોર્મ પણ ખાતાની વેબસાઇટ ઉપરથી મેળવવા સલાહભર્યું છે.

(૧૦) વેટ ઇ-પેમેન્ટ :-

- (૧) જે વેપારીઓએ ગત વર્ષમાં કે ચાલુ વર્ષમાં રૂ. ૧૦ લાખ થી વધુ વેરો ભરેલો હોય તેમણે વેટનું ચલણ ઇ-પેમેન્ટ થી ભરવું ફરજિયાત છે. આ માટે જરૂરી પાસવર્ક ફેસીલીટી નેક્માં થી મેળવીને ઇ-પેમેન્ટ કરવું પડે. એકંદરે આ પદ્ધતિ સારી છે કારણ રાતના ૧૧ વાગ્યા સુધીમાં ગમે ત્યારે ઇ-પેમેન્ટ થઈ શકે છે.
- (૨) જે વેપારીઓને વેરો રૂ. ૧૦ લાખથી ઓછો ભરવાનો હોય તેઓ પણ મરજિયાત રીતે ઇ-પેમેન્ટ થી વેટનું ચલણ ભરી શકે છે.

(૧૧) એક્ષપોર્ટ કે આંતરરાજ્ય/ખંડ વેચાણ ના 'C' - ફોર્મ 'H' ફોર્મ કે 'F' ફોર્મ કચેરીમાં રજુ કરવા અંગે :-

- (૧) જે તે હક્કમાં 'H' - ફોર્મ સામે એક્ષપોર્ટ કે 'H' - ફોર્મ સામે આંતરરાજ્ય વેચાણ કે 'F' - ફોર્મ સામે ખંડ વેચાણ કરેલું હોય તે હખ્તો પૂરો થયેથી આવા 'H' - ફોર્મ કે 'C' - ફોર્મ કે 'F' - ફોર્મ ત્રણ મહીનાની અંદર વેટ કચેરીમાં લીસ્ટ સાથે રજુ કરવા ફરજિયાત છે.
- (૨) એટલે જે વેપારીઓને આ જોગવાઈ લાગુ પડતી હોય તેમણે હમો પૂરો થયેથી ત્રણ માસની અંદર તેમના ખરીદનારાઓ પાસેથી જે તે ફોર્મ મંગાવી લઈ પોતાના લેટરપેડ ઉપર વિગતવાર લીસ્ટ બનાવીને વેટ કચેરીમાં રજૂ કરી પાવતી મેળવી લેવી જોઈએ.

(૧૨) કલમ-૧૪ હેઠળ અડધો ટકો લંપસમ ટેક્સ ભરવાનો ઓપ્શન રૂ. ૫૦ લાખ સુધીનું ટર્ન ઓવર ધરાવતા ટ્રેડિંગ કરતા નાના વેપારીને મળે છે. તાજેતરમાં ગુજરાત સરકારે બજેટમાં કરેલ જાહેરાત મુજબ આ લાભ તા. ૧-૪-૨૦૧૩ થી રૂ. ૭૫ લાખ સુધીનું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને મળી શકશે. અને આવો લંપસમ ટેક્સ ભરવાનો ઓપ્શન લેવો હોય તો તારીખ ૩૦-૪-૨૦૧૩ સુધીમાં અરજી કરી શકાશે. એટલે જે વેપારી ભાઈઓને આ ઓપ્શન લેવો હોય તેમણે અમારો સંપર્ક કરવો. જે કે વર્ષ દરમિયાન આવા વેપારીનું ટર્ન ઓવર જો રૂ. ૭૫ લાખથી વધી જાય તો જે તારીખે ટર્ન ઓવર વધે તે તારીખથી લંપસમનો ઓપ્શન કેન્સલ થઈ જાય અને રૂટીન ડીલર તરીકે ટેક્સ ભરવાની જવાબદારી ચાલુ થઈ જાય ઉપરાંતમાં આવા વેપારી જો કરચોરીમાં સંડોવાયેલ હોય તેવું પુરવાર થાય તો પણ લંપસમનો ઓપ્શન કેન્સલ થઈ જાય.

(૧૩) કલમ 14B હેઠળ લંપસમ પાંચ વેંસા ભરવાનો ઓપ્શન ધરાવતા કમિશન એજન્ટ જો ગુજરાત રાજ્ય બહારથી માલ ખરીદે કે માલ વેચવા માટે મંગાવે કે ગુજરાત બહાર માલનું વેચાણ કરે કે માલ વેચવા મોકલે તો લંપસમ ટેક્સ ભરવાનું લાયસન્સ ઓટોમેટીક કેન્સલ થઈ જાય છે, એટલે આવા વેપારી ભાઈઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.

(૧૪) અગત્યની બીજી જોગવાઈઓ :

- (૧) જે વેપારીઓને વેટ ઇનપુટની મોટી રકમની કેડીટનું રીફંડ લેવાનું બાકી નીકળતું હોય તે માટે જરૂરી અરજી કરી પ્રોવિઝનલ રીફંડની માંગણી કરી શકાય આ માટે અમારો રૂબરૂ સંપર્ક કરવો.
- (૨) એ ખાસ નોંધવું જરૂરી છે કે પ્રોવિઝનલ રીફંડ માટે જેટલી રકમની અરજી કરવામાં આવે તેની ઇનપુટ કેડીટ પછીના મહીનામાં માંગી શકાશે નહીં.
- (૩) વર્ષ દરમિયાન ઘંઘાના સ્થળમાં કે બંધારણમાં ફેરફાર થાય કે નવું ગોડાઉન રાખવામાં આવે કે કોઈ ગોડાઉન ખાલી કરવામાં આવે તો તેવી બાબતોની જાણ વેટ કચેરીમાં ૧ માસની અંદર કરવી જરૂરી છે.



(૧૪)

- (૪) તેવી જ રીતે વર્ષ દરમ્યાન કોઈ બેંકમાં નવું ખાતું ખોલાવવામાં આવે કે ચાલુ કોઈ ખાતું બંધ કરવામાં આવે તો તે અંગેની જાણ ૧૦ દિવસની અંદર વેટ કચેરીમાં કરવી જરૂરી છે.
- (૫) એટલે ઉપર પ્રમાણે વર્ષ દરમ્યાન જો કોઈ ફેરફાર થાય તો તુરતજ અમોને જાણ કરવી જેથી સમયસર વેટ કચેરીમાં તે અંગેની જરૂરી અરજી અને પુરાવા રજુ કરી શકાય કારણ આવી ફેરફાર ની જાણ જો મોડી કરવામાં આવે તો દરરોજનો રૂ. ૧૦૦/- લેખે દંડ થાય છે.
- (૬) વેટ નંબર મેળવતી વખતે ફોર્મ નં. 101-C માં જેનો સહીનો નમૂનો આપ્યો હોય તે નમૂના પ્રમાણે ની સહી ટેક્સ ઇન્વોઇસ માં કરવી જરૂરી છે. કારણ સહી મળતી નથી એ મુદ્દા ઉપર ઇન્વોઇસની રકમના ૧૦% દંડ થાય છે. અને ખરીદનારને ટેક્સ ઇન્વોઇસ પ્રમાણેના ટેક્સની ક્રેડીટ મળે નહિ. એટલે ટેક્સ ઇન્વોઇસમાં સહી કરવી અને બેંકના ચેકમાં સહી કરવી બંને સરખું છે માટે કાળજી લેવી અને આ રીતે આપેલ સહીના નમૂના માં ફેરફાર કરી શકાય પણ તે માટે નવું ફોર્મ 101-C ભરવું પડે.
- (૭) વેટ કાયદા હેઠળ કે CST કાયદા હેઠળ પત્રક મોડા ભરવા માટે રોજના રૂ. ૧૦૦/- થી શરૂ કરીને રૂ. ૧૦૦૦૦/- સુધીનો દંડ થઈ શકે છે.
- (૮) વેટ રીટર્નમાં વેટની ઇનપુટ ક્રેડીટ ખરીદીના ટેક્સ ઇન્વોઇસ પ્રમાણે માંગેલી હોય પણ જ્યારે આવી ઇનપુટ ક્રેડીટ નું કોસ વેરીફિકેશન થાય ત્યારે તમે જેની પાસેથી માલ ખરીદ કરેલ હોય તેણે ટેક્સ ઇન્વોઇસ માં વસૂલ કરેલો ટેક્સ ભર્યો ના હોય તો ટેક્સ ક્રેડીટ મળે નહિ અને તે ઉપરાંત આવી ક્રેડીટ ની રકમના ૧૫૦% લેખે દંડ થાય એટલે આપણે જેની પાસેથી ખરીદી કરીએ છીએ તે રેગ્યુલર વેપારી છે. અને રેગ્યુલર વેટ ભરે છે તેની આપણે કાળજી લેવી જરૂરી છે નહિતર આવા બોગસ વેપારીના કારણે આપણે ખોટી રીતે દંડાવાનું થાય.

(૩૭) વ્યવસાય વેરો :-

- (૧) વ્યવસાય વેરાનો વહિવટ હવે વેટ કચેરી પાસે નથી પરંતુ જે તે ગામની મ્યુનીસીપાલિટી કે પંચાયત પાસે છે. કારણ વ્યવસાય વેરાની જે આવક થાય તે તેમની આવક છે.
- (૨) જે વેપારીઓએ અત્યાર સુધી આ રીતે જે તે મ્યુનીસીપાલિટી કે પંચાયતમાં વ્યવસાય વેરો ના ભર્યો હોય તેમણે ત્યાંથી વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ અરજી કરી મેળવી લેવું જરૂરી છે.

(૩૭) તાજેતરમાં આવેલ બજેટમાં સુચવેલ ઇન્કમટેક્સ કાયદાના સુધારાની જાણ બજેટ પાસ થયેથી જુન માસમાં કરીશું

અમે આશા રાખીએ છીએ કે ઉપર પ્રમાણે ઇન્કમટેક્સ તથા વેટ અંગેની મુખ્ય મુખ્ય બાબતોની છણાવટ અને માર્ગદર્શન આપને ઉપયોગી થાશે. તથા આ અંગે વિશેષ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરવો.

લી.
 ઘીરુભાઈ - કનુભાઈ
 પીયુષભાઈ - નીખીલભાઈ